



ફિલાડેલ્ફિયામાં વીકએન્ડની ઉજવણીમાં
ગોળીબાર : 3 લોકોનાં મોત, 11 ઘાયલ

PAGE NO. 19

સ્વદેશ

પરદેશમાં દેશની મહેક એટલે

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dr: 647-995-5640
amitgshah@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dr: 647-624-5640
komal4gshah@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 10 JUNE, 2022 Vol. 19, No. 23 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

યુકેનના યુદ્ધને કારણે વિશ્વના 94 દેશોમાં મોટા આર્થિક સંકટના એધાણ 1.6 અબજ લોકો પર ભૂખમરાનું સંકટ: UN

વિશ્વભરના લોકો પૈસા, ખાદ્યપદાર્થો અને ઊર્જાની સમસ્યાનો સામનો કરવા મજબૂર, ઈંધણની કિંમત આસમાને



યુકેન

યુકેનના યુદ્ધને કારણે વિશ્વના 94 દેશોમાં સંકટ સર્જાયું છે અને કુલ 1.6 અબજ લોકો હેરાન થયા છે. સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ કાર્ઈસિસ રિસ્પોન્સ ગ્રુપમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વભરના લોકો પૈસા, ખાદ્યપદાર્થો અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. 8મી જૂને પ્રકાશિત થયેલા આ અહેવાલમાં ખાદ્યપદાર્થો અને ઈંધણની કિંમતો પર નિયંત્રણ રાખવાની વાત કરવામાં આવી છે.

આ ઉપરાંત સામાજિક સુરક્ષા યોજનાઓ અને આર્થિક સહયોગ વધારવાની પણ વાત કરવામાં આવી છે જેથી નબળા વર્ગના લોકોને મદદ કરી શકાય. આટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, સમય ઓછો છે અને ખાદ્યપદાર્થોની કટોકટી સૌથી મોટી છે.

અહેવાલમાં જણાવ્યા આનુસાર, 2023માં ખાદ્યપદાર્થોની મોટી કટોકટી ઊભી થઈ શકે છે. જો આવી સ્થિતિ જોવા મળશે તો લોકો માટે ખોરાકની અછત સર્જાશે અને ખોરાકની ઉપલબ્ધતા ઘટી જશે. જો યુદ્ધ ચાલુ રહેશે તો આવતા વર્ષે કટોકટીની સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે જ ઘઉં, મકાઈ અને શાકભાજી સહિત અનેક ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે. લગભગ 2 અબજ લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. આ આંકડો ખૂબ મોટો છે. યુકેન યુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો વધી રહી છે. આ સિવાય ઘઉંના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. UN સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે, યુકેન સંકટવિશ્વવ્યાપી સંકટ તરફ દોરી શકે છે. આ સંકટ કોઈપણ દેશ અથવા લોકો માટે મુશ્કેલ સમાન બનશે. તેમણે કહ્યું હતું કે, યુકેન અને રશિયા યુદ્ધને 3 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને હવે લોકોને નવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કરાચીમાં હિન્દુ મંદિરમાં દેવી-દેવતાની પ્રતિમાઓની તોડફોડ

કરાચી

પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ અંગે આપણે બધા જ જાણીએ છીએ. પાકિસ્તાનમાંથી ઘણીવાર ધાર્મિક ઉત્પીડનની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવી જ એક ઘટના કરાચી ખાતે ઘટી છે જેમાં હિન્દુઓના મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના કરાચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, બુધવારના રોજ કરાચીના કોરંગી વિસ્તારમાં આવેલા શ્રી મારી માતા મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. ઉપરોક્ત ઘટનાથી કરાચી ખાતેના અને તેમાં પણ ખાસ કરીને કોરંગી વિસ્તારના હિન્દુ સમુદાયના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જ્યાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

આ વિસ્તારના રહેવાસી એવા હિન્દુ સમાજના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું

હતું કે, બાઈક ઉપર આવેલા દુધી ૮ લોકોએ મંદિર ઉપર હુમલો કર્યો હતો. કોરંગીના સ્ટેશન ઈન્ચાર્જ ફાટ્ક સંજરાનીએ જણાવ્યું હતું કે, પથી ૬ અજાણ્યા શખ્સો મંદિરમાં પ્રવેશ્યા હતા અને તોડફોડ કરીને ભાગી ગયા હતા.

તેમણે કહ્યું કે મંદિર ઉપર હુમલો કરનારા અજાણ્યા લોકોની સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં પણ ઘણી વખત પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોને ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ઓક્ટોબરમાં કોટરી ખાતે સિંધુ નદીના કિનારા ઉપર આવેલા એક ઐતિહાસિક મંદિરને અજાણ્યા શખ્સોએ ટાર્ગેટ કર્યું હતું. તે અંગે કોટરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સત્તાવાર આંકડા પ્રમાણે ત્યાં ૭૫ લાખ હિન્દુઓ રહે છે. જો કે હિન્દુ સમુદાયના લોકોના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં ૮૦ લાખથી વધુ હિન્દુઓ વસે છે. પાકિસ્તાનની મોટાભાગની હિન્દુ વસ્તી સિંધ પ્રાંતમાં વસેલી છે.

ABOWATH REAL ESTATE GROUP
VALUING REAL ESTATE TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 892 4585
More Info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

OFFICE SPACE FOR RENT
At : Markham & Ellesmere
Ideal For : Tuition Class, Real Estate Broker, Tailoring Business Etc. Etc.

Total Area 300 Sq Ft Including Storage Space Rent \$600/ Month Including Utilities

Lease Term : Flexible & Negotiable
Contact : Prakash Sapra
416-820-9117

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada

bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel
Cell: 647-502-8069
Fax: 416-253-9461

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુઆમાં રાખે સખરો
Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1



ટોરોન્ટોમાં એફોર્ડેબલ યુનિટસના ચાર ટાવર બંધાશે

3.5 એકરમાં બનનારા નવા પ્રોજેક્ટથી 1400 યુનિટ ઉપલબ્ધ બનશે, એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં ધ્યાન આપવા સરકારને અપીલ



ઓન્ટેરિયો

ટોરોન્ટોની રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીએ કહ્યું હતું કે તેઓ મકાનની તંગીના નિવારણ માટે શહેરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસિંગના ચાર ટાવર બાંધવાનું વિચારી રહ્યા છે. સ્પોટલાઈટ ડેવલપમેન્ટ આઈએનસી ૧૫૫૧ ૩૫ માળના ટાવર બાંધવા માંગે છે. જેમાં કોન્ડો ઓનરશીપ અને રેન્ટલ યુનિટસનો સમાવેશ થશે. જેમાં ૭૦ ટકા યુનિટસ એફોર્ડેબલ હશે. આ મિશ્ર ઉપયોગનું ડેવલપમેન્ટ લોરેન્સ એવેન્યુ બ્લેક કીક

ડ્રાઈવ નજીક ૩.૫ એકર વિસ્તારમાં ફેલાયેલા સ્ટ્રીપ મોલ પ્લાઝામાં થશે. આ ટાવર તૈયાર થઈ જશે. એટલે ૧૪૦૦થી વધુ યુનિટસ ઉપલબ્ધ થઈ શકશે. જે લગભગ એક મિલિયન ચો. ફૂટ જેટલું બાંધકામ હશે. સ્પોટલાઈટ ડેવલપમેન્ટના પ્રેસીડેન્ટ શેરી લારજાનીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો આશય સમાજને કંઈક પરત આપવાના અભિગમનો છે. કંપની જરૂરી વધારે કરવા માંગે છે. અમને કોઈએ એફોર્ડેબલ હાઉસિંગ માટે ફરજ પાડી નથી. પણ અમે જ એમ નક્કી કર્યું છે કે, આ પ્રોજેક્ટનો મોટોભાગ

એફોર્ડેબલ હાઉસિંગનો હોવો જોઈએ. જેથી ટોરોન્ટો શહેરના જરૂરતમંદોને એનો લાભ મળી શકે. જો કે ખરેખર તો સરકારે આ દિશામાં આગળ વધવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે માગ વધારે છે અને પુરવઠો ઓછી હોવાથી તંગીની સ્થિતિ ઉભી થઈ છે. અમે બીજા ડેવલપર્સને પણ એફોર્ડેબલ હાઉસિંગ તરફ વાળવા માંગીએ છીએ. વળી અમે પણ અન્ય ચાર જેટલી બિન નફાકારક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે પણ એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં વધુ ધ્યાન આપવું જોઈએ.

ફ્લોરીડા પ્રાઈડ કાર્યક્રમમાં ગોળીબાર પ્રકરણમાં કેનેડિયન તરૂણની ધરપકડ

ઈવેન્ટના સમયે લીડને ડરાવવા ગોળીબાર કર્યો હોવાનું પોલીસનું તારણ ટોરોન્ટો

કેનેડામાં એક સત્તર વર્ષીય તરૂણની પોલીસે ધરપકડ કરી હતી. જેની સામે ફ્લોરીડા પ્રાઈડ કાર્યક્રમ દરમિયાન ટોળામાં ગોળીબાર કરીને ડર ફેલાવવાનો આરોપ હતો. વેસ્ટ પામ બીચ પોલીસ વિભાગના જણાવ્યા મુજબ સોમવારની વહેલી સવારે ભાતમીને આધારે આ તરૂણની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં ટોરોન્ટો અને પીલની સ્થાનિક

પોલીસ અને એફબીઆઈ જોડાયા હતા. ધરપકડ થઈ ત્યારે એ તરૂણ ઓમેગલે વીડિયો ચેટ સાઈટ પર વ્યસ્ત હતો. એણે ઈવેન્ટના સમયે ભીડને ડરાવવા ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, વીડિયો ચેટમાં પણ એની પાસેની ગન જોવા મળી હતી. ધરપકડ ઓન્ટેરિયોથી થઈ હતી અને હવે એને અમેરિકા લઈ જવાશે. જ્યાં એના ઉપર કેટલાક ગુનાઓ નોંધાયેલા છે. સગીર વયનો હોવાથી પોલીસે એની ઓળખ જાહેર નથી કરી. પોલીસે જણાવ્યું હતું કે, ઘટના સ્થળે લોકો ખૂબ ડરી ગયા હતા. જુન ૨૦૧૬માં એક ગનમેને કરેલા ગોળીબારમાં ૪૮થી વધુના મોત થયા હતા અને પડને ઈજા પહોંચી હતી.



ગ્રામ્પટન

રાશી અને નવલ બજાજ દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું. ધર્મપ્રેમી શ્રીગુરુજી અશ્વિનકુમાર પાઠક આ તકે ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સભા મંદિર ખાતે ૪ જૂન,



૨૦૨૨ના રોજ બ્રામ્પટનમાં યોજાયેલા કરવા સુંદરકાંડ પાઠનો મુખ્ય હેતુ આ ધાર્મિક માર્ગને શક્ય તેટલા વધુ લોકો સુધી લઈ જવાનો છે. સુંદરકાંડનો પાઠ કરવાથી માનસિક શાંતિ તો મળે જ છે. સાથે સાથે તમારા

કાર્યોમાં સફળતા હાંસલ કરવા માટે શક્તિ મળે છે. સુંદરકાંડનો મુખ્ય ઉદ્દેશ્ય નમ્ર જીવન જીવવાનો છે. બ્રામ્પટનમાં ચોથી જૂને સુંદરકાંડ પાઠમાં પાંચ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.

લંડન ખાતે એન્ટી-ઈસ્લામોફોબિયા રેલી



રંગભેદ વિરોધી નીતિઓને વધુ કડક બનાવીને નવો કાનૂન લાવવા ટુડોની ખાતરી ઓન્ટેરિયો

ઓન્ટેરિયોના લંડન ખાતે રવિવારે ઈસ્લામોફોબિયાના વિરોધ માટે નીકળેલી રેલીમાં વડાપ્રધાન સહિત સેંકડો લોકો જોડાયા હતા. લંડનની મુસ્લિમ મસ્જિદ સુધીની રેલીની શરૂઆત ૧૦૦૦થી વધુ લોકો ઓકીજ સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયેલા સમારંભમાં વક્તવ્યો સાંભળવા હાજર રહ્યા હતા. જે રેલીની શરૂઆત પહેલાનો સમારંભ હતો. ગયા વર્ષે ઈસ્લામોફોબિયાને કારણે હત્યાકાંડમાં મૃત્યુનો ભોગ બનેલા અફઝલના પરિવારની યાદમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને લોકોએ ઈસ્લામોફોબિયાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રેલીમાં ભાગ લેવા પરિવાર સાથે આવેલી આયશા રાશીદે કહ્યું હતું કે, એ અમારા મિત્રો હતા. આજે અને આવતીકાલની આ ઈવેન્ટથી અમે એના પરિવારને મદદ કરવા માંગીએ છીએ.

ગયા વર્ષે બનેલી ઘટનામાં ૪૬ વર્ષીય અફઝલ અને એની ૪૪ વર્ષીય પત્ની મધીહા સલમાન અને તેમની ૧૫ વર્ષીય પુત્રી યુમ્મા અને ૭૪ વર્ષીય દાદી તલત અફઝલના મૃત્યુ થયા હતા. જ્યારે રસ્તા ઉપર ચાલતી વખતે એક વાહનના ડ્રાઈવરે તેમને કચડી નાંખ્યા હતા. પરિવારના એકમાત્ર બચી જનાર સભ્ય નવ વર્ષનો પુત્ર હતો, જે ઈજા છતાં બચી ગયો હતો. ડ્રાઈવર ઉપર હત્યાના ચાર આક્ષોપો અને હત્યાના પ્રયાસના આરોપો અને ત્રાસવાદના આરોપો પણ લગાડવામાં આવ્યા હતા. યુમ્માના મિત્રો ૮મા ધોરણના વિદ્યાર્થીઓ છે, જે રવિવારના કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમના આયોજક સેલ્મા તોબાહને ખ્યાલ પણ નહોતો કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન ટુડો અચાનક આવીને જોડાશે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો. વડાપ્રધાન ટુડોએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, એમની સરકાર રંગભેદ વિરોધી નીતિઓને વધુ કડક બનાવીને નવો કાનૂન લાવશે અને કેનેડામાં એન્ટી ઈસ્લામો ફોબિયા માટે પહેલા પ્રતિનધિની નિમણૂક કરશે.

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો. મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX #1 with ABOWATH your Local REALTOR

તંત્રી સ્થાનેથી

ભાજપી નેતાઓના વાણીવિલાસથી ભારતને સમગ્ર દુનિયામાં નીચાજોણું

ભારતીય રાજકારણમાં છેલ્લાં 8 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. ખાસ કરીને ભાજપી નેતાઓમાં એલફેલ બોલાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે ઘડાતી રણનીતિના ભાગરૂપે ભાજપ હંમેશા આ જ નીતિ અપનાવે છે. જેને કારણે મુખ્ય મુદ્દાઓ કોરાણે મુકાઈ જાય છે. ભાજપના નેતાઓ હંમેશા મુસ્લિમ ધર્મને અને ધર્મગુરુઓને ઊતારી પાડવામાં પરાક્રમ કરતા હોય તે રીતે

તંત્રી - પ્રકાશક સ્વદેશ

ઘણાં સમયથી વર્તી રહ્યા હતા. જ્યારે મુસ્લિમ સમાજ તરફથી રોષ ઠલવાય ત્યારે ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર રીતે તેને વખોડી કાઢવામાં આવે છે. પરંતુ હાલમાં જ નુપુર શર્મા અને નવીન જીંદાલ કે જેઓ ભાજપના સત્તાવાર પ્રવક્તા હતા તેઓએ એક ટીવી ડિબેટમાં મહોમ્મદ પયગમ્બર સાહેબ વિષે કરેલા અણછાજતાં વિધાનો હવે ભાજપ જ નહીં પરંતુ સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગયા છે.

નુપુર શર્મા અને નવીન જિંદાલે કરેલા વાણીવિલાસથી ભારતના 20 કરોડ મુસ્લિમોની ધાર્મિક લાગણી દૂભાઈ તેની સરકારને બિલકુલ પરવા નહોતી, પરંતુ 20 ઈસ્લામિક દેશો દ્વારા તેનો જે રીતે સજ્જડ વિરોધ કરવામાં આવ્યો તેને કારણે ભાજપને પગલાં ભરવાની ફરજ પડી છે. ઈસ્લામિક દેશો સાથે ભારતના જે આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધો છે તે જોતાં ભાજપના નેતાઓની હેટ સ્પિચ ભારતના અર્થતંત્રને મોટું નુકસાન કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભારતમાં હિન્દુત્વનું પુનઃજાગરણ થઈ રહ્યું હોય, તે દેશના 100 કરોડ હિન્દુઓ માટે ગૌરવરુપ છે. પરંતુ આ પુનઃજાગરણ મુસ્લિમો પ્રત્યે ધિક્કાર અને તિરસ્કારના પાયા ઉપર હશે તો ભારતના બીજી વખત ભાગલા થયા વિના રહેશે નહીં. ભાજપના અનુરાગ ઠાકુર, તેજસ્વી સૂર્યા, ગિરિરાજ સિંહ, કપિલ મિશ્રા અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘણાં સમયથી એલફેલ બોલવાની રેસમાં ઉતાર્યા હોય તેમ જણાય છે. ભાજપના આવા નેતાઓની હેટ સ્પિચને કારણે કરોડો હિન્દુઓના મતો મળી શકે છે પણ તેનાથી દેશમાં જે નફરતનો માહોલ પેદા થાય છે તેનાથી એકંદરે તે દેશને જ નુકસાન થઈ રહ્યું છે.

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાઓ નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા યોજનાબદ્ધ રીતે ટાઈમ્સ જૂથની નવભારત ચેનલ ઉપર વાણીવિલાસ કરાયા તેનાથી હવે મોટો વિવાદ ખડો થઈ ગયો છે. આ વિવાદના પડઘા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા છે. મુસ્લિમ દેશોએ ભારતમાં થયેલી આ ગતિવિધિનો સખત વિરોધ કરીને સરકાર પર જવાબદારો સામે પગલા ભરવા દબાણ શરૂ કર્યું છે. જેને પગલે બંને નેતાઓની હાલ તો પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

આ સાથે જ ભાજપે તાબડતોબ બેઠક યોજીને પ્રવક્તાઓ માટે નવી ગાઈડલાઈન તૈયાર કરાઈ છે. ભાજપ દ્વારા રોષે ભરાયેલા ઈસ્લામિક દેશોના ગુસ્સાને શાંત પાડવા નિવેદનમાં જે ડાહી ડાહી વાતો કરવામાં આવી છે, તેમાં ભારતની ધાર્મિક સહિષ્ણુતાની પરંપરાની દુહાઈ દેવામાં આવી છે અને ભારતના બંધારણના પાયાના મૂલ્યોને પણ યાદ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે ભાજપના પ્રવક્તાઓ જાહેરમાં જ્યારે ઈસ્લામની બદબોઈ કરતા હોય ત્યારે તેઓ આ હકીકત કેમ ભૂલી જાય છે? ભાજપના નેતાઓ દ્વારા જે રીતે વાણીવિલાસ કરાય છે તે હકીકતમાં તો ભાજપની કૂટનીતિનો એક ભાગ છે.

એલ્લા કેટલાક સમયથી હિન્દુત્વના પુનર્જાગરણના નામે ભારતના વિવિધ ભાગોમાં જે ધર્મ સંસદો યોજવામાં આવે છે, તેમાં નફરત ફેલાવતા ભાષણો કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવે છે. આ બાબતમાં સરકારનું ધ્યાન દોરવામાં આવે અને ટીકાનો ધોધ વહેતો થાય, તે પછી હેટ સ્પિચ આપનારા તથા કથિત સંતો અને મહંતો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે. નુપુર શર્મા અને નવીન જિંદાલના જાહેર ઉચ્ચારણો બાબતમાં ભાજપે ઘૂંટણિયે પડવું પડ્યું, તેની પાછળ સર્વધર્મ સમભાવની ભાવના કામ નથી કરી ગઈ પણ ઈસ્લામિક દેશોની જાગરૂકતા અને એકતા કામ કરી ગઈ છે. ઈસ્લામિક દેશો સાથે ભારતના ગાઢ વેપારી સંબંધો છે. યુનાઈટેડ આરબ અમીરાતની કુલ વસતિના 35% ભારતીયો છે, તો કુવૈતની 24% અને કતારની 26% વસતિ ભારતીયોની બનેલી છે. ભારત તેની જરૂરિયાતનું 60% ખનિજ તેલ આરબ દેશોમાંથી આયાત કરે છે. જો તેઓ ભારત સાથેનો વેપાર બંધ કરે તો ભારતમાં કટોકટી જાહેર કરવી પડે.

ભારતમાં આયાત અને નિકાસ વચ્ચેની જે ખાઈ છે, તેને પૂરવામાં ગલ્ફમાં વસતા ભારતીયો દ્વારા કરાઈને મોકલવામાં આવતા અબજો ડોલર ભારત માટે સંકટમોચકનું કામ કરે છે. ભારતમાં જે વિદેશી હૂંડિયામણ કમાણીના રૂપમાં આવે છે, તેના 50%થી વધુ અખાતી દેશોમાંથી આવે છે. જો ભારતમાં આ હૂંડિયામણનો પ્રવાહ બંધ થઈ જાય તો ભારતની હાલત પણ શ્રીલંકા જેવી થઈ જાય તેમ છે. ભારત સરકારને આ વાતની બરાબર જાણ હોવાથી, તેણે કટોકટી ટાળવા હવે પગલાં ભરી રહી છે.

ઈસ્લામિક દેશો દ્વારા પયગમ્બર સાહેબના અપમાન સામે જે ચાંપતાં પગલાંઓ લેવામાં આવ્યા, તેમાંથી હિન્દુ પ્રજાએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. ભારતમાં અને વિદેશોમાં દાયકાઓથી હિન્દુ દેવી - દેવતાઓનું અપમાન કરવાનો અને તેમને ઊતારી પાડવાનો ટ્રેન્ડ ચાલે છે. M. F. હુસૈન જેવા પેઈન્ટરો દ્વારા હિન્દુ દેવી - દેવતાના બિભત્સ ચિત્રો દોરવામાં આવ્યા હતા. અમેરિકામાં ઘણી વાર ગંજી અને જાંઘિયા પર હિન્દુ દેવી - દેવતાઓની તસવીરો છાપવામાં આવતી હોય છે. ભારતમાં હિન્દુત્વનો ઠેકો લઈને બેઠેલી ભારત સરકારે ક્યારેય તેની સામે વિરોધ નોંધાવ્યો હોય કે અમેરિકાના માલનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોય તેવું જાણમાં આવ્યું નથી.

ભાજપ અને સંઘપરિવારને હિન્દુત્વ માટે કેટલો પ્રેમ છે? તે સમજવા માટે ગોવા તેમજ ઈશાન ભારતના રાજ્યોમાં તેની બીફ માટેની નીતિ જાણવા જેવી છે. ભાજપ અને સંઘપરિવાર સત્તાવાર રીતે ગૌહત્યાના વિરોધી છે અને બીફ ખાવાની કલ્પના પણ કરતા નથી. તેમની આ કટ્ટરતા કાઉ બેલ્ટ પૂરતી જ મર્યાદિત છે. ગોવામાં અને ઈશાન ભારતમાં ખ્રિસ્તીઓની મોટી વસતિ છે અને બીફ તેમના માટે સંવેદનશીલ મુદ્દો છે.

જો આ રાજ્યોમાં ભાજપ બીફનો વિરોધ કરે તો તે ક્યારેય સત્તા હાંસલ કરી શકે નહીં. આ કારણે આ રાજ્યોમાં ભાજપ બીફનું સમર્થન કરીને ચૂંટણી જીત્યો છે. હકીકતમાં ભારતમાં લાંબા સમય સુધી સત્તા પર રહેવા માટે ભાજપે હવે ખરા અર્થમાં વિકાસનો મુદ્દો અપનાવવો જોઈએ. અત્યાર સુધી ધાર્મિક ભાવનાને આધારે જ ભાજપે ચૂંટણીઓ જીતી છે. કોંગ્રેસ પણ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિમાં દેશનું ભલું કરી શક્યો નથી. તેવા સમયે ભાજપે હવે સાચા અર્થમાં વિકાસકામો સાથે જનતા સમક્ષ જવું જોઈએ.

Manoj Gandhi

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

- ✓ Mice
- ✓ Rat
- ✓ Cockroach
- ✓ Bedbug
- ✓ Animal Control
- ✓ Bird Control
- ✓ WASPS and
- ✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.
Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator



DIVINE YOGA
By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

**: Classes Available :
One to One Individual
and Therapeutic**

Geeta Tailor
416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



વડોદરાની ક્ષમા બિંદુએ 40 મિનિટની ડિજિટલ વિધિ સાથે આત્મવિવાહ કર્યા

વડોદરા

હું ઘણી જ ખુશ છું, આખરે મારા લગ્ન થઈ ગયા છે એ ક્ષમા બિંદુના શબ્દો છે જેણે આત્મ-વિવાહ કરી લીધા છે. ક્ષમાના લગ્નના નિર્ણય બાદ તેના સમર્થનમાં અને વિરોધમાં એમ બે વલણ જોવા મળ્યા હતા. જોકે ૨૪ વર્ષની ક્ષમા આખરે પરણી ગઈ છે. દુલ્હન બનેલી ક્ષમા પણ બુધવારે ઘણી જ ખુશ દેખાતી હતી. ક્ષમાના લગ્ન બાકીના લગ્નો કરતા એકદમ અલગ હતા, કારણ કે અહીં દુલ્હને પોતાની જાત સાથે લગ્ન કર્યા છે. ક્ષમાએ ૧૧ જૂને આત્મ-વિવાહ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ પછી તેણે પોતાનો નિર્ણય બદલ્યો અને ૮ જૂને જ આત્મ-વિવાહ કરવાનું નક્કી કરી લીધું હતું. શરુઆતમાં ક્ષમા મંદિરમાં આત્મ-વિવાહ કરવાનું નક્કી કર્યું હતું, જોકે, વિરોધનું વંદોળ ઉભું થતા અને ભારતીય સરકારની વિરુદ્ધમાં આ છોકરી પગલું ભરી રહી હોવાનું સામે આવતા તેણે મંદિરમાં લગ્ન-વિધિ કરવાનું ટાળ્યું છે. ૨૪ વર્ષની ક્ષમા



બિંદુએ બુધવારે ગોત્રીમાં આવેલા પોતાના ઘરે જ ૪૦ મિનિટની ડિજિટલ વિધિ સાથે તેના મિત્રોએ જીવનભર સાથ આપવાનો વચન આપીને ફૂલોનો વરસાદ કર્યો હતો. આ લગ્નમાં સૌથી મહત્વના ગણાતા પૂજારી અને વરની ગેરહાજરી હતી. ક્ષમાએ પોતાના લગ્ન અંગે જણાવ્યું કે, અન્ય દુલ્હન કરતા મારા લગ્ન એકદમ અલગ હતા, મારે લગ્ન કરીને ઘર છોડવું પડ્યું નથી. ૨૪ વર્ષની પોતાની જાત સાથે લગ્ન કરનારી ક્ષમાએ કહ્યું કે, ઉતાવળે કરેલા આ લગ્નના સમારંભમાં મારા ૧૦ મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું.

બીએસએફમાં નોકરીને બહાને આણંદના યુવકે 25 લોકો પાસેથી રૂ.15 લાખ ખંખેર્યા

જુમસરના ખેડૂતની ફરિયાદ બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો

મોડાસા

ભિલોડા પંથક સહિતના વિસ્તારના ખેડૂત સહિત ૨૫થી વધુ ઉમેદવારોને બીએસએફમાં નોકરી આપવાના બહાને એક ગઠીયાએ છેલ્લા ૧ વર્ષમાં જુદાજુદા બહાને રૂ.૧૫,૦૮૧૮૦ ની રકમ પડાવી બીએસએફના નક્લી ખોટા દસ્તાવેજો બનાવી ઠગાઈ આચરતાં ચક્રચાર મચી હતી. જુમસરના એક ખેડૂતની ફરીયાદ બાદ ભિલોડા પોલીસે મૂળ બાયડના પરંતુ હાલ આણંદ રહેતો

ગઠીયા વિરૂધ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે બીએસએફના નામે ચક્રચારી ઠગાઈ પ્રકરણની વધુ તપાસ જિલ્લા એલસીબી શાખાને સોંપાઈ હતી. ભિલોડા પોલીસે આરોપી ચિરાગભાઈ અનુલભાઈ પટેલ (ઉ.વ.૨૮, જિ.અરવલ્લી) હાલ રહે. શેઠવાળુ ફળીયુ, અરજપુરા,તા.જિ. આણંદ નાઓ વિરૂધ્ધ છેતરપિંડી,ઠગાઈ અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets **10% Off** on your first home service
**Mention this offer while booking*

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા ક્યોરી, સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી (with sweet & Farsan)	Limited થાળી (without sweet & Farsan)
\$9.00 +Tax	\$7.50 +Tax

CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber

Call us for details

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪
૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

Franchise Opportunity in GTA

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

વડોદરાની 24 વર્ષની યુવતીએ 17,346 ફૂટ ઊંચું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યું

યુવતીએ 3 મહિના સુધી રોજ 5 કિ.મી. દોડીને અને 20 કિલોની બેગ ઊંચકી પ્રેક્ટિસ કરી હતી

વડોદરા

૨૪ વર્ષની આઈટી પ્રોફેશનલ યુવતીએ હિમાચલ પ્રદેશના કુલુ ડિસ્ટ્રિક્ટમાં પીર પંજાલ અને ધૌલાધાર પર્વતમાળા વચ્ચે આવેલ ૧૭,૩૪૬ ફૂટ ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કર્યું છે. આમ તો આ શિખર ઘણા લોકો સર કરે છે પરંતુ આ યુવતી પ્રથમ વખત જ પર્વતારોહણ કરી રહી હતી છતાં કુદરતી આફત વચ્ચે અને માઈનસ ૧૦ ડિગ્રી તાપમાનમાં શિખરની ટોચે પહોંચવામાં સફળ થઈ હતી. અટલાદરા



વિસ્તારમાં રહેતી અને હાલમાં મુંબઈ ખાતે આઈટી કંપનીમાં કામ કરતી ૨૪ વર્ષની ભક્તિ ખખ્ખરે જીવનમાં પ્રથમ વખત જ પર્વતારોહણ કર્યું હોવા છતાં તે તેમાં સફળ રહી હતી. ભક્તિ કહે છે કે

આમ તો હું નાના મોટા ટ્રેકિંગ કેમ્પમાં જતી હતી. મેં ગુજરાત કોસ્ટલાઈન સાયકલિંગમાં ૧૧ દિવસમાં ૧,૬૦૦ કિ.મી. સાયકલિંગ કર્યું હતું, પરંતુ પર્વતારોહણ પ્રથમવાર કરી રહી હતી, જે માટે મેં ૩ મહિના સુધી રોજ ૫ કિ.મી. દોડીને અને ૨૦ કિલોની બેગ ઊંચકી ૧૦ માળ સુધી પગથિયા ચઢ-ઉતર કરીને પ્રેક્ટિસ કરી હતી. અમદાવાદ અને વડોદરાના કુલ ૧૨ લોકોએ આ સાહસની શરૂઆત કરી હતી જેમાં મારા સહિત બે યુવતીઓ હતી.

લુણા ગામમાં ઘરમાં ભૂલથી આવેલા યુવાનની પિતા અને પુત્રે હત્યા કરી

પાદરા

ઝારખંડના મૂળ રહીશ સુરેશ ઉર્ફે બુધન શંકરભાઈ યાદવ સમીયાલા પાસે નવા એક્સપ્રેસ હાઈવે પર ફેબ્રિકેશનનું કામ કરે છે. તેના વતનમાં મનોજ પ્રયાગ ચૌધરી(ઉ.વ.૩૨)ને કામની જરૂર હોવાથી સુરેશ ઉર્ફે બુધને મનોજને પોતાની સાઈટ પર બોલાવી લીધો હતો. તા.૪ના રોજ સવારે તે તેના નાના ભાઈ સાથે વડોદરા આવી ગયા બાદ સુરેશ ઉર્ફે બુધન સાથે જ રહેતો હતો. મનોજને ખેંચની બીમારી હોવાથી તેને ગઈકાલે બપોરે ખેંચ આવતાં તેની એસએસજીમાં સારવાર કરાવી હતી. બાદમાં તેને ઘેર લાવ્યા હતાં. જો કે રાત્રે

અચાનક તે ગાયબ થઈ ગયો હતો અને બીજા દિવસે ખબર પડી હતી કે તેની લાશ લુણા ગામની સીમમાં આમોલી કંપની તરફ જવાના રોડ પરથી મળી છે. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મનોજ ભૂલથી લુણા ચાર રસ્તા પાસે રહેતા ભયલાલ ડાહ્યાભાઈ પઠિયારના ઘરમાં રાત્રે ઘૂસી ગયો હતો અને તેને ભયલાલ તેમજ તેના પુત્ર અરવિંદ માર માર્યો હતો. માર મારતા તેને ઘરની બહાર લાવ્યા હતા અને બાદમાં બંને જતા રહ્યા હતાં. પિતા અને પુત્રના મારથી મનોજનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાદરા પોલીસે હત્યાના ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

વડોદરામાં રેપ વિથ મર્ડરના આરોપીએ જેલમાં જ ફાંસો ખાઈને આપઘાત કર્યો

વલસાડ

છોટાઉદેપુરના કાંતિભાઈ લટુભાઈ રાઠવા (ઉ.વ.૪૫) ને વર્ષ-૨૦૦૭ ના રેપ વિથ મર્ડર કેસમાં આજીવન કેદ થઈ હતી. અને વડોદરા સેન્ટ્રલ જેલમાં તે સજા કાપી રહ્યો હતો. ગઈકાલે સાંજે જેલ બંધ થયા પછી એક કેદી ગણતરીમાં ઓછો થતા જેલ સ્ટાફે તપાસ કરતા કાંતિભાઈની પથારી ખાલી હતી. જેથી, જેલ સ્ટાફે તપાસ કરતા કાંતિભાઈએ વણાટ વિભાગમાં ગાદલા અને ૩ બનાવવાના મશીન પાસે એક ટેબલ પર સુતરની આંટી વડે ફાંસો ખાઈ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા એ.સી.પી.મેઘા તેવારે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. કેદીને જેલમાં અન્ય કોઈ કેદી કે જેલ સ્ટાફ સાથે કોઈ અણબનાવ નહોતો.

બ્રેનડેડ બહેર થયેલી એન્જિનિયર યુવતીના પાંચ અંગોનું દાન કરાવ્યું

વડોદરા


મલ્ટિ નેશનલ કંપનીમાં નોકરી કરતી ઈલેક્ટ્રિકલ એન્જિનિયર યુવતીને બે દિવસ પહેલા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેનડેડ જાહેર કરી હતી. પરિવારની સંમતિ બાદ તેનું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળ જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરવામાં આવ્યા છે. વડોદરાની કોમલ પટેલ ચાર ધામ યાત્રાએ ગઈ હતી. કેદારનાથથી ઘરે પરત ફર્યા બાદ તેને માથાનો ગંભીર દુખાવો શરૂ થયો હતો. તેમજ અચાનક આંચકીઓ આવવા લાગી. જેથી તેને પ્રાથમિક સારવાર

માટે પરિવારજનો નજીકના ક્લિનિકમાં લઈ ગયા હતા. પરંતુ, તેની તબિયત નહી સુધરતા વધુ સારવાર માટે વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ, યુવતીની સ્થિતિ ઝડપથી બગડતા તેને વેન્ટિલેટરના સપોર્ટ પર મૂકવામાં આવી હતી. ડોક્ટર્સની ટીમના પ્રયાસો પછી પણ તેને બચાવી શકાઈ નહતી અને ડોક્ટરે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. હોસ્પિટલના સ્ટાફે તેમના પરિવારને અંગદાનના ઉમદા કાર્યની જાણ કરી હતી. અમદાવાદ અને મુંબઈના ડોક્ટર્સની ટીમે ૨૪ કલાકની અંદર અંગ પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

ડાકોર મંદિરે પૂનમના દિવસે દર્શનના સમયમાં વધારો કરવા નિર્ણય

નડિયા

ડાકોરમાં પૂનમના દિવસે ઠાકોરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ૧૪મી જૂનને જેઠ સુદ પૂનમના દિવસે ઠાકોરમાં હજારો યાત્રાળુઓ ઠાકોરના દર્શન માટે પધારશે. આ દિવસે સવારે ૬ વાગે નિજમંદિર ખુલીને ૫.૧૫ વાગે મંગળા આરતી થશે. ત્યાર બાદ ૮.૩૦ વાગ્યા સુધી શ્રીજીના દર્શન ખુલ્લા રહેશે. ૮.૩૦થી ૯ વાગ્યા સુધી ઠાકોરજી ટેરામાં બાલભોગ, શણગારભોગ અને ગ્વાલભોગ આરોગવા બિરાજશે. આ સમય દરમિયાન શ્રીજીના દર્શન બંધ રહેશે. સવારે ૯ વાગ્યાથી શરૂ થયેલા શ્રીજીના દર્શન ૧૨.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ૧૨.૩૦થી ૧ સુધી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW


ZIVASA
 Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
 Broker

દાદીની આત્માની શાંતિ માટે હત્યા કેસના આરોપીને જેલમાં ધાર્મિક ગ્રંથ આપવા હુકમ

આરોપીએ અરજી કરી 15 દિવસના વચગાળાના જામીન માંગતા કોર્ટે નકારી કાઢ્યા

સુરત
કતારગામ પોલીસે વર્ષ-2021માં ગેરકાયદે મંડળી રચીને પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને હત્યાનો પ્રયાસ,હત્યા તથા એટ્રોસીટી એક્ટના ભંગના ગુનામાં 19 વર્ષીય આરોપી મિત ઉર્ફે હેડન ગૌરીશંકર પંડ્યા (રે. માસ્કિનંદન એપાર્ટમેન્ટ, કતારગામ) ની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. હાલમાં જેલવાસ ભોગવતા આરોપી યુવાને તા.27મી મેના રોજ પોતાના દાદીનું અવશાન થયું હોઈ મરણોત્તર

વિધી માટે 15 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવા માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આરોપીના મૃતક દાદીની આત્માની શાંતિ માટેની ધાર્મિક વિધી અન્ય સગા કરી શકે તેમ ન હોવાથી ધાર્મિક વિધીમાં હાજરી આપવા આરોપીને વચગાળાના જામીન આપવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવારે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધની કેસ કાર્યવાહી પુરી થવાના આરે છે.

આરોપીને હત્યા જેવા ગંભીર ગુનામાં જામીન આપવાથી નાસી ભાગી જવાની સંભાવના છે. આરોપીના મોટાભાઈ મૃતક દાદીની ધાર્મિક વિધી કરી શકે તેમ છે. જેના માટે આરોપીને હાજરી જરૂરી નથી. જેથી કોર્ટે વચગાળાના જામીનની માંગ નકારી કાઢી આરોપીના મૃતક દાદીની આત્માની શાંતિ માટે જેલમાં જ જે કોઈ ધાર્મિક ગ્રંથનું પઠન કરવા માંગતા હોય તે નિયમો મુજબ મળે તેની વ્યવસ્થા કરવા માટે જેલ ઓથોરિટીને કોર્ટે નિર્દેશ આપ્યો છે.

સુરતમાં ત્યકતાને પ્રેમસંબંધમાં ફસાવી પ્રેમી અને મિત્રનું દુષ્કર્મ

સુરત
રંદિરમાં ફૂટપાથ પર ધંધો કરતી ત્યકતાને પ્રેમજાળમાં ફસાવી મળવાના બહાને પોતાના ઘરે બોલાવી પ્રેમી અને તેના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હતો. ઉમરા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કથિત પ્રેમી સહિત બેની ધરપકડ કરી છે. રંદિરમાં ફૂટપાથ પર પરચૂરણ ધંધો કરતી ત્યકતા મિનલ (ઉ.વ. 27 નામ બદલ્યું છે) નજીકમાં જ ફૂટપાથ પર માસ્કનું વેચાણ કરતા જયેશ બોડેડકર નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયેશ મિનલને મળવા માટે પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં જયેશ મિનલ સાથે લગ્ન કરવાની લાલચ

આપી શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશ પ્રેમિકા મિનલને તેના મિત્ર યોગી પવારને હવાલે કરતા તેણે મિનલ પર બળાત્કાર કર્યો હતો. પોતાનું સ્વસ્વ પ્રેમીના હવાલે કરનાર મિનલને પ્રેમી જયેશ તેના મિત્ર યોગીને હવાલે કરતા ચોંકી ગઈ હતી. જયેશ યોગીને હવાલે કર્યા બાદ તેના બીજા મિત્ર મૂવને હવાલે કરતા મિનલે તેનો પ્રતિકાર કરી તાબે થઈ ન હતી. જેથી જયેશ મિનલને માર પણ માર્યો હતો પરંતુ જયેશ અને તેના મિત્રોના સંક્રજામાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. મિનલ ભાગી જવામાં સફળતા જયેશ તેને કોઈને જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.

સુરતમાં તાપી નદીના પાળા બનાવવા મહત્વીપલ ઉપયોગ થાય તેવી ડિઝાઇન બનશે

સુરત
સુરતમાં હાલમાં જ તાપી નદીમાં બેરેજની કામગીરીના કામનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે. કેટલાક સર્વે બાદ બેરેજ માટેની સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવશે, આ કામગીરી શરૂ થાય તે પહેલા તાપી નદી પર કેટલીક જગ્યાએ પાળા નથી તે જગ્યાએ પહેલાં પાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જો પાળા ન બને અને બેરેજની કામગીરી શરૂ થઈ જાય તો તાપી નદીમાં પાણી છોડવામાં આવે તો સૌથી પહેલાં બદીનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિત અડાજણ વિસ્તારમાં પાળા ન હોય રંદિર જોન વિસ્તારમાં પાણી પ્રવેશી શકે તેમ છે. તેને ધ્યાનમાં રાખીને બેરેજ પહેલા પાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

બિહારની 4 હાથ-પગ સાથે જન્મેલી બાળકીને સુરતના તબીબીએ ઉગારી

અભિનેતા સોનુ સુદે ગરીબ પરિવારને સારવાર માટે સુરત મોકલાયું હતું

સુરત
અઢી વર્ષની ચહુમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. પટણા ખાતે જન્મેલી ચહુમુખીને જન્મતા જ ચાર હાથ અને ચાર પગ હતાં. જેને કારણે બાળકીને હરવા ફરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચાર હાથ અને ચાર પગ ધરાવતી બાળકી જન્મી ત્યારે તેનું શરીર જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. જેથી બાળકીનું નામ ચહુમુખી આપવામાં આવ્યું હતું. ચહુમુખીને જન્મથી જ ૪ હાથ અને ૪ પગ હતા.

સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ ત્યારે સોનુ સુદે તે જોયું અને તેના તરફથી બાળકનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી. ચહુમુખીનો પરિવાર ૩૦ મેના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદેને મળ્યો હતો. સોનુ સુદે ચહુમુખીની સારવાર માટે પરિવારને સુરત મોકલ્યો હતો. જ્યાં પહેલા ચહુમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આઠ દિવસ અગાઉ બાળકીને સોનુ સુદેના કહેવા પર સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. જ્યાં ચહુમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન

સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની યાત્રા માટે તૈયારી શરૂ

સુરત
આગામી તારીખ 1 જુલાઈના રોજ સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની યાત્રા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સુરતના ઈસ્કોન મંદિરમાં 130 મીટર કાપડનો ઉપયોગ કરીને રથના ધુમટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મોટા રથની સાથે સાથે નાના રથના ધુમટ માટે પણ કામગીરી ચાલી રહી છે. આ રથયાત્રાને સફળ બનાવવા માટે મંદિર દ્વારા પણ અત્યારથી જ આયોજન કરવામા આવી રહ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન બિરાજમાન થાય તેની ઉપર મોટો ધુમટ બનાવવામાં આવે છે. આ ધુમટ માટે છેલ્લા સાતેક વરસથી મંદિર દ્વારા એક મહિલાને કામગીરી સોંપવામાં આવે છે.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

icrc
CRCIC

SPOUSAL SPONSORSHIP SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on

416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton

- Fanshawe
- Georgian
- Algoma
- Canadore

- Algoma
- Saskatchewan polytechnic
- Mohawk

ONLINE IELTS SPOKEN ENGLISH CLASSES ON ZOOM

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS / DETENTION REVIEWS / CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

CANADA	94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855
VADODARA	101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817
AHMEDABAD	139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

Job Offer & LMIA

Entrepreneur

Investor Business

Self Employed

Farm Investor

Email.: info@siis.ca / Website.: www.siis.ca



સોનાક્ષી અને ઝાહીરે જાહેરમાં પ્રેમસંબંધ સ્વીકાર્યો

થપ્પડ સે ડર નહીં લગતા સાહબ, પ્યાર સે લગતા હૈ...આ સોનાક્ષી સિંઘાનો ફિલ્મ પડદા પરનો ફેમસ ડાયલોગ છે. જોકે, હવે સોનાક્ષીએ કોઈ ડર કે સંકોચ વિના જ ઝાહીર દકબાલ સાથેના પોતાના પ્રેમસંબંધો જાહેર કરી દીધા છે. સોનાક્ષીના જન્મદિને ઝાહીર દકબાલે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. તેણે સોનાક્ષીનો વીડિયો શેર કર્યો હતો સોનાક્ષીએ વળતી કોમેન્ટમાં લવ યુ કહીને પ્રેમનો સ્વીકાર કર્યો છે. આ બંનેની કોમેન્ટસને હુમા કુરેશી, તારા સુતરિયા, પત્રલેખા, વરૂણ શર્મા સહિતના બોલિવુડના મિત્રો દ્વારા લવ ઈમોજી દ્વારા વેલકમ પણ કરવામાં આવી છે.



સ્પર્દેશ

FRIDAY, 10 JUNE, 2022

09

કાજોલનો ખુલાસો: મારે હિરોઈન ન હતું બનવું, નોકરી કરવી હતી



મુંબઈ: અભિનેત્રી કાજોલે એવો ખુલાસો કર્યો છે કે તેને ક્યારેય બોલિવુડમાં પ્રવેશવાની અને હિરોઈન બનવાની તમન્ના હતી જ નહીં, તેને એવી કોઈ સીધી સાદી નોકરી કરવી હતી જેમાં દર મહીને નિયમિત પગાર આવી જતો હોય. કાજોલે આ ખુલાસો કૌન બનેગા કરોડપતિ શો નાં મરાઠી વર્ઝન કોન હોનાર કરોડપતિમાં ભાગ લેતી વખતે કર્યો હતો. મરાઠીમાં આ શો વિખ્યાત અભિનેતા સચિન ખેડેકર હોસ્ટ કરી રહ્યા છે. કાજોલ અને તેની માતા તનુજા બંનેએ આ શો માં ભાગ લીધો હતો. કાજોલે જણાવ્યું હતું કે મને ક્યારેય બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ બનવાની ઈચ્છા થઈ જ ન હતી. બધું આપોઆપ થતું ગયું હતું. મારી ઈચ્છા એવી હતી કે હું કોઈ નોકરી કરું જેનો એક નિયમિત સમય હોય અને દર મહીને તમારા બેન્ક ખાતામાં પગારનો ચેક જમા થયા કરે. સચિને ખેડેકરે આ તબક્કે કાજોલને કહ્યું હતું કે જે થયું તે સારું થયું નહીં તો અમે તમારાં શાનદાર પરફોર્મન્સ સિસ કર્યાં હોત. કાજોલની પહેલી ફિલ્મ બેપુદી ફલોપ થઈ હતી. કાજોલે અગાઉ પણ જણાવ્યા અનુસાર ત્યારે જ તેણે વિચાર્યું હતું કે પોતે એક્ટિંગને કેરિયર નહીં બનાવે. જોકે અનાયાસે તેની કેરિયર આગળ વધતી ગઈ અને તેને દિલવાલે દુલહનિયા લે જાયેંગ જેવી ભારતની સૌથી સફળ ફિલ્મોમાંની એક મળી. કાજોલ એક બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેની માતા તનુજા અને નાની શોભના સમર્થ ઉપરાંત માસી નૂતન પણ પોતપોતાના જમાનામાં સફળ અભિનેત્રી રહી ચૂક્યાં છે.

કરીના કપૂર ખાન 40,000 રૂપિયાની ટી-શર્ટ પહેરવા બદલ ટ્રોલ થઈ



કમલ હાસનની વિક્રમ સામે ટીલી પડી સમ્રાટ પૃથ્વીરાજ

૩ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી યશરાજ બેનરની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' સુસ્ત થઈ ગઈ છે. હાલત એ છે કે દર્શકોની ઓછી સંખ્યાને જોતા અનેક શહેરોમાં ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે. ઐતિહાસિક યુદ્ધ ડ્રામા ફિલ્મથી અક્ષય કુમાર સહિત નિર્માતાઓને આશા હતી પરંતુ તે તેમના પર ખરી ઉતરી નહોતી. 5 દિવસ બાદ પણ ફિલ્મનો 5 કરોડનો આંકડો હજુ દૂર છે. વિશ્લેષકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે જો આગામી 2 દિવસમાં ફિલ્મ આ જ પ્રદર્શન કરતી રહેશે તો તે આપત્તિજનક સાબિત થશે.



'સમ્રાટ પૃથ્વીરાજ'ની શરૂઆત ઠીક-ઠીક જોવા મળી હતી. બાદમાં જ્યારે વીકએન્ડમાં ફિલ્મના કલેક્શનમાં વધારો જોવા મળ્યો ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, તે આવનારા દિવસોમાં સારો દેખાવ કરી શકે છે પરંતુ સોમવારે તેની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ જ ટ્રેન્ડ મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. મોટા ભજેટની આ ફિલ્મ 5માં દિવસે ફલોપ થતી જોવા મળી રહી છે.

મિતાલી રાજની અનટોલ સ્ટોરી 'શાબ્બાશ મિઠુ' 15મીએ રિલીઝ થશે

મુંબઈ: તાપસી પન્નુની 'શાબ્બાશ મિઠુ' 15 જૂલાઈ 2022ના રોજ સિલ્વર સ્ક્રીન રિલીઝ થશે. 'શાબ્બાશ મિઠુ'ની રિલીઝ ડેટ અંગે બોલીવુડ સ્ટાર તાપસી પન્નુએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર કરી હતી. સાથે જ તેણે અગાઉ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું હતું. જેમાં તે ક્રિકેટના ગ્રાઉન્ડમાં શોટ લેતી જોવા મળી હતી. 'શાબ્બાશ મિઠુ' ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં મિતાલી રાજના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ, નિષ્ફળતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, મિતાલીએ 2 દશકાથી પણ વધુ સમયની ક્રિકેટ કરિયર નિર્માતાઓને ઘણી દરમિયાન રાજ કર્યું છે. મિતાલી રાજ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર આશા હતી પરંતુ તે તેમના વિશ્વના શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાંથી એક છે. મિતાલીના નામે વનડેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. સાથે જ ભારત માટે સૌથી લાંબા 5 દિવસ બાદ પણ ફિલ્મનો 50 સમય સુધી કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે જ કરોડનો આંકડો હજુ દૂર છે. ટ્રેડ છે. તાપસીએ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની વિશ્લેષકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે. તાપસીએ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના કે જો આગામી 2 દિવસમાં ફિલ્મ આ જ રીતે 'મિતાલી રાજ'ના પાત્ર માટે તાપસી કહે છે પ્રદર્શન કરતી રહેશે તો તે આપત્તિજનક સાબિત થશે. કે વાસ્તવિક જીવનમાં હું મિતાલી જેવી બિલકુલ નથી.



બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન જ્યારે પણ ધરની બહાર નીકળે છે ત્યારે ફેશનના મુખ્ય લક્ષ્યોને પૂરા કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. તે પછી કેઝ્યુઅલ આઉટફિટ હોય, સ્ટાઈલિશ ડ્રેસ હોય કે ટ્રેડિશનલ આઉટફિટ હોય, બેબો કોઈપણ આઉટફિટમાં લોકોનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ તે કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી અને જેના કારણે તે ટ્રોલ થઈ હતી.

કરીના કપૂર કેઝ્યુઅલ આઉટફિટ અને ફ્લેટ ફૂટવેરમાં સ્પોર્ટી લુક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી પરંતુ તેનાથી પણ વધારે તેની ટી-શર્ટ લોકોને આકર્ષિત કર્યા હતા. કરીનાની ગુચ્છી યેલો ટી-શર્ટની કિંમત તમારા હોશ ઉડાવી દે તેવી હતી. આ ટી-શર્ટની કિંમત 40,000 રૂપિયા છે પરંતુ કરીનાનો મોંઘો લુક નેટીઝસને આકર્ષવામાં સફળ નહોતો રહ્યો. ઘણા યુઝર્સ તેને મોંઘી ગુચ્છી ટી-શર્ટને લઈને ટ્રોલ કરી હતી. કરીનાની વાયરલ તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝર્સે લખ્યું હતું કે, અમારે ત્યાં 200 રૂપિયાની ટી-શર્ટ આના કરતાં વધુ સારી લાગે છે. સાથે જ તમને જણાવી દઈએ કે, કરીના કપૂર ખાન શાહી જીવન જીવે છે અને તેની પાસે કપડામાં 50થી વધુ ગુચ્છી ટી-શર્ટ છે.

આઈફામાં શેરશાહ શ્રેષ્ઠ ફિલ્મ, વિકી કૌશલ બેસ્ટ એક્ટર, કિતી સેનોનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

અબુધાબી ખાતે યોજાયેલા 22મા આઈફા એવોર્ડમાં શેરશાહને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી છે. જોકે, તે એક્ટિંગના ટોપના એવોર્ડ ચુકી ગઈ છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ સરદાર ઉધમસિંહ માટે વિકી કૌશલને મળ્યો છે જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કિતી સેનોનને મિમિ માટે મળ્યો છે.

વિકી કૌશલે પોતાનો એવોર્ડ દિવંગત અભિનેત ઈરફાન ખાનને અર્પણ કર્યો હતો. વિકીએ કહ્યું હતું કે આ મારી જિંદગીનો બેસ્ટ એક્ટર તરીકેનો પહેલો એવોર્ડ છે અને હું તેને મારા આરાધ્ય અભિનેતાને અર્પણ કરવા માંગું છું.

અબુધાબીના યસ આઈલેન્ડ ખાતે ઈતિહાદ એરેનામાં આઈફા એવોર્ડ સંબંધિત વિવિધ ઈવેન્ટ ત્રણ દિવસ માટે યોજાઈ હતી. શનિવારે રાતે એવોર્ડઝની જાહેરાત થઈ હતી. શેરશાહને કુલ પાંચ એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત દિગ્દર્શનનો એવોર્ડ વિષ્ણુવર્ધનને મળ્યો હતો. જોકે, તેણે બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ અતરંગી રે સાથે શેર કરવો પડ્યો હતો. જોકે, બેસ્ટ પ્લેબેક સિંગર મેલ અને ફિમેલ બંને એવોર્ડ શેરશાહના સૌંદર્ય રાત 1 લંબિયા લંબિયા માટે જુબિન નૌતિયાલ અને અસીસ કૌરને ભાગે આવ્યા હતા.



બેસ્ટ લિરિક્સનો એવોર્ડ લહેરે દો માટે કૌસલ મુનિરને મળ્યો હતો. આ સમારોહમાં એકસાથે બે વર્ષની ફિલ્મોને એવોર્ડ અપાયા હતા. તે સંદર્ભમાં 2020માં રજૂ થયેલી લ્યૂડો માટે અનુરાગ બસુને બેસ્ટ ઓરિજનલ સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો. તેમણે આ એવોર્ડ કોરોનામાં ગયા વર્ષે મૃત્યુ પામેલા ફિલ્મના એડિટર અજય શર્માને અર્પણ કર્યો હતો. જ્યારે બેસ્ટ એડેપ્ટેડ સ્ટોરીનો એવોર્ડ 73 ફિલ્મ માટે કબીર ખાન અને સંજય પુરણસિંહને મળ્યો હતો. બેસ્ટ સર્પાટિંગ એક્ટર માટે મેલ કેટેગરીમાં લ્યૂડો માટે પંકજ ત્રિપાઠી અને ફિમેલ કેટેગરીમાં ફિમેલ માટે સાઈ તામ્હેણકરને એવોર્ડ અપાયા હતા. સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પોલે એવોર્ડ નાઈટ હોસ્ટ કરી હતી. અભિષેક બચ્ચન, ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે, સારા અલી ખાન, નોરા ફતેહીએ પરફોર્મન્સ આપ્યાં હતાં.



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

 માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!
 રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



આતંકવાદીઓના ટાર્ગેટ કિલિંગના રસ્તાને કારણે કાશ્મીરખીણના હિંદુઓમાં દહેશત

1990નું પુનરાવર્તન ? : પંડિતો હિજરતના મૂડમાં

કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મનું ભારતભરમાં પ્રમોશન કરવામાં સફળ થયેલી ભાજપ સરકાર હવે કાશ્મીર ખીણમાં વસતાં કાશ્મીરી પંડિતોને સુરક્ષા કરવામાં નિષ્ફળ જઈ રહી છે. કુલગામના મહિલા શિક્ષકની હત્યા બાદ બીજા 2 હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આતંકવાદીઓ સફળ થયા છે. છેલ્લાં એક મહિનામાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગનો માર્ગ અપનાવ્યો છે. જેમાં ખાસ કરીને હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં સુરક્ષાદળોનો અડીંગો અને ખાસ બંદોબસ્ત છતાં આતંકી ઘટના બની રહી હોવાથી ભાજપ સરકાર ઉપરથી કાશ્મીરી પંડિતોનો વિશ્વાસ ઉઠવા માંડ્યો છે. ગત અઠવાડિયે જ અહીંથી હજારો પંડિતોએ સામૂહિક હિજરતની ચીમકી આપી હતી.

આમ તો 370ની કલમ દૂર કર્યા બાદ મોટી સરકાર કાશ્મીરમાં સ્થિતિ થાળે પડી રહી હોવાનો દાવો કરતી રહી છે. દર અઠવાડિયે આઠથી દશ આતંકીઓના એન્કાઉન્ટ કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી આતંકવાદીઓમાં ખોફ પેદા થયો નથી. જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાનની વિશેષ યોજના હેઠળ કાશ્મીર ખીણમાં જમ્મુના આશરે 4000 કાશ્મીરી પંડિતોને સરકારી નોકરી આપીને વસાવવામાં આવ્યા હતા. કાશ્મીર ખીણના ગંડેરબાલ, બડગામ, અનંતનાગ, બારામુલ્લા અને કુપવાડા જિલ્લાઓમાં આવા લોકો માટે ખાસ કોલોનીઓ બનાવવામાં આવી હતી. કિન્તુ આતંકવાદીઓ કોઈ પણ ભોગે આ હિન્દુઓને કાશ્મીર ખીણમાંથી હાંકી કાઢવાનો મનસુબો ધરાવે છે. 1990ના દાયકામાં કાશ્મીર ખીણમાં જેવી પરિસ્થિતિ હતી તેવી જ સ્થિતિ ફરી સર્જાઈ રહી છે. 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં ગવર્નરનું શાસન હતું, તેવી જ રીતે 2022માં ગવર્નરનું શાસન છે. 1990માં કેન્દ્રમાં જનતા દળની લઘુમતી સરકાર સત્તામાં હતી, જેના વડાપ્રધાન V.P. સિંહ હતા અને જેને ભાજપનો બહારથી ટેકો હતો.

1990માં ભાજપ પક્ષ કાશ્મીરી પંડિતોની હિજરત કદાચ અટકાવી ન શક્યો હોય, કારણ કે તે સરકારમાં નહોતો. પરંતુ આજે તો સ્પષ્ટ અને પ્રચંડ બહુમતિ સાથે તે કેન્દ્રમાં સત્તામાં છે. વળી, મોટી અને અમીત શાહ તેના સુકાની હોવા સાથે કાશ્મીરમાં ગવર્નરનું શાસન છે, જેની ધૂરા કેન્દ્રના હાથમાં રહેલી છે. તેમ છતાં ટાર્ગેટ કિલિંગ થકી આતંકવાદીઓ કાશ્મીરી પંડિતોમાં દહેશત ઉભી કરવી રહ્યા છે. છેલ્લાં એક મહિનામાં 9 લોકોની હત્યા થઈ છે. આથી પંડિતો પાસે હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ જ રહ્યો નથી. હિજરત કરી



રહેલા પંડિતોને તેમના ઘરમાં નજરકેદ કરવાથી કોઈ સમસ્યા હલ થવાની નથી.

મે મહિનામાં જ કાશ્મીરમાં રાજ કરી રહેલા આતંકવાદીઓ દ્વારા 7 ઈસમોની ટાર્ગેટ્સ હત્યા કરવામાં આવી છે. જેમાં 4 નાગરિકો હતા અને 3 પોલીસ કર્મચારીઓ હતા. તા. 12 મેના રોજ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં રાહુલ ભાટ નામના કાશ્મીરી પંડિતની હત્યા લશ્કરે તોઈબા નામના સંગઠન દ્વારા કરાઈ હતી. કાશ્મીર ખીણમાં 9 ટાર્ગેટ્સ હત્યા થયા પછી કાશ્મીરી પંડિતોએ મોટી સંખ્યામાં ભિસ્તરા-પોટલા બાંધીને જમ્મુ તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે, કે, 6 જૂન સુધીમાં તેમને સલામત સ્થળ પર રહેઠાણ આપીને ખસેડવામાં આવશે. આ સાંત્વના ઉપર કાશ્મીરી પંડિતોને કોઈ ભરોસો ન હોવાથી તેઓ હાઈવે

પ્રાસંગિક
ધવલ શુક્લ

ભારતમાં 370ની કલમ દૂર કર્યા બાદ કાશ્મીરમાં સ્થિતિ થાળે પડી રહ્યાનો દાવો થઈ રહ્યો છે ત્યારે આતંકવાદીઓએ એક મહિનામાં 9 હત્યા કરી સરકારને ફરી લલકારી છે

પર જમ્મુ તરફ જતા નજરે પડ્યા હતા. તેમને રોકવા માટે સરકાર દ્વારા શ્રીનગર - જમ્મુ હાઈવે પર ઠેક ઠેકાણે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. તેઓ જમ્મુ તરફ જતા દરેક મુસાફરના I - CARD ચેક કરે છે. જો કોઈ કાશ્મીરી પંડિત જમ્મુ તરફ જતા જોવા મળે તો તેમને રોકવામાં આવે છે અને પાછા શ્રીનગરના ટ્રાન્સલિટ કેમ્પમાં મોકલી આપવામાં આવે છે. શ્રીનગરના ઈન્દિરા

નગર વિસ્તારમાં સરકારે કાશ્મીરી પંડિતોના રહેવાની વ્યવસ્થા કરી છે. સરકાર દ્વારા હિન્દુ કર્મચારીઓ માટે મકાનો ભાડે લેવામાં આવ્યાં છે અને હોટેલોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગભરાટમાં આવેલા કાશ્મીરી પંડિતો આ કોલોની પણ ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમને રોકવા માટે સરકાર દ્વારા પ્રવેશદ્વાર ઉપર કાંટાળા વાયરની આડશ ઊભી કરી દેવામાં આવી છે.

શ્રીનગરની જેમ કાશ્મીર ખીણના દરેક જિલ્લાઓમાં બહારથી આવેલા હિન્દુ કર્મચારીઓ માટે સ્પેશિયલ સરકારી વસાહતો ઊભી કરવામાં આવી છે. ગંડેરબાલ જિલ્લાના તુલ્લામુલ્લા વિસ્તારમાં, બડગામ જિલ્લાના શખપુરા વિસ્તારમાં, અનંતનાગ જિલ્લાના વીસુ વિસ્તારમાં તેમજ બારામુલ્લા અને કુપવાડામાં પણ ખાસ વસાહતો ઊભી કરવામાં આવી છે.

કાશ્મીરી પંડિતો મોટી સંખ્યામાં આવતા હોય છે.

ગયા 2 વર્ષ કોરોનાને કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પરિસ્થિતિ સામાન્ય જણાતા ખીરભવાની મેળાનું આયોજન તા. 8 જૂને થનાર હતું. પણ કાશ્મીર ખીણની પરિસ્થિતિ વણસી જતા કાશ્મીરી પંડિતોના સંગઠને મેળો રદ કરવાની જાહેરાત કરી છે. જો ખીરભવાની મેળો રદ કરવામાં આવે તો સરકારનું નાક કપાઈ જાય તેમ છે. તેથી સરકાર દ્વારા મેળો યોજાય તેવી મથામણ કરાઈ રહી છે. પણ હિન્દુઓ ત્યાં જવા તૈયાર નથી. કાશ્મીર ખીણ છોડીને ભાગી રહેલા મોટાભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ તરફ જઈ રહ્યા છે. તેમને લાગે છે કે જમ્મુમાં તેઓ સલામત છે, કારણ કે, જમ્મુની 65 % વસતિ હિન્દુ છે. 1990ના દાયકામાં કાશ્મીરમાં પંડિતો ઉપર અત્યાચારો થયા ત્યારે તેઓ પહેલા જમ્મુ પહોંચ્યા હતા. ત્યાં તેમના માટે બનાવવામાં આવેલી કામચલાઉ છાવણીઓમાં તેમણે આશરો લીધો હતો. ત્યાર પછી કાશ્મીર ખીણમાં રહેલી પોતાની મિલકતો વેચીને તેઓ જમ્મુમાં કે નવી દિલ્હીમાં સ્થાયી થયા હતા. આજે ઘણા કાશ્મીરી પંડિતો જમ્મુને પોતાનું ઘર બનાવીને રહ્યા છે પણ તેઓ જમ્મુના હિન્દુઓ કરતા અલગ સંસ્કૃતિ ધરાવે છે. હવે કાશ્મીર ખીણના બાકીના હિન્દુઓ પણ જમ્મુમાં વસવાટ કરવાની ઈચ્છા રાખી રહ્યા છે.

કેન્દ્ર સરકાર તેમને રોકવાના પ્રયત્નો કરી રહી છે, કારણ કે તેને ઈજ્જત જવાનો ડર છે. 2014માં ભાજપની સરકાર આવી તે પછી કાશ્મીરી પંડિતોને પાછા કાશ્મીર ખીણમાં સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે તેમને કાશ્મીર ખીણમાં વિવિધ સ્થળો પર નોકરીઓ આપવામાં આવી હતી અને રહેઠાણની સગવડ પણ કરવામાં આવી હતી. હવે આતંકવાદીઓ આ સરકારી નોકરી કરતા કાશ્મીરી પંડિતોને જ મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. તેને કારણે ભયભીત થયેલા કાશ્મીરી પંડિતો તેમની નોકરીઓ જમ્મુમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી રહ્યા છે. કાશ્મીરમાં આ ઉનાળામાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા હતા. આતંકવાદીઓ દ્વારા એક પણ પ્રવાસી ઉપર હુમલો કરવામાં આવ્યો નહોતો. કારણ કે, તેમના ઉપર કાશ્મીરનું અર્થતંત્ર ચાલે છે. આતંકવાદીઓના કાશ્મીરી પંડિતો ઉપરના હુમલાઓ વધી ગયા છે, તેનું કારણ એ છે કે ત્યાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે. આવા સંજોગોમાં કાશ્મીરમાં પંડિતોની હાજરી આતંકવાદીઓને ટેકો આપતા સ્થાનિક પક્ષોની ગણતરી બગાડી શકે છે.

મની લોન્ડરિંગનો આરોપ

AAP નેતા સત્યેન્દ્ર જૈનના મિત્રના ઘરેથી રૂ. 2.80 કરોડની રોકડ અને સોનું જપ્ત

ઈડીએ સત્યેન્દ્ર જૈનને રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કરાતાં તેમને 13 જૂન સુધી ઈડી કસ્ટડીમાં મોકલવા હુકમ કરાયો હતો

નવી દિલ્હી

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈન ઉપર મની લોન્ડરિંગનો આરોપ લાગતા તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે તેમની મુશ્કેલીઓ વધતી દેખાય છે. જાણકારી પ્રમાણે EDએ જૈનના નજીકના મિત્રના ઘરેથી 2.82 કરોડ રૂપિયા રોકડા અને મોટા પ્રમાણમાં સોનું જપ્ત કર્યું છે. EDને દરોડા દરમિયાન મોટી સંખ્યામાં રોકડની સાથે સોનાના બિસ્ક્રીટ અને 133 સોનાના સિક્કા પણ મળ્યા છે. બીજી તરફ ઈડીની ટીમે ગુરુવારે દિલ્હીના

આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા તે પછી કોર્ટે તેમને 13 જૂન સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતા.


EDની ટીમ સત્યેન્દ્ર જૈનના અનેક સ્થળો ઉપર દરોડા પાડી રહી છે. આ દરમિયાન ED હવાલા ઓપરેટર્સના અનેક ઠેકાણાં પર પણ દરોડા પાડી રહી છે. આ દરોડામાં જૈનના નજીકના મિત્રના ઘરેથી આશરે 3 કરોડ કેશ મળી આવી છે. જોકે ઈડીની આ કાર્યવાહીને અગાઉ દિલ્હીની આપ સરકાર વખોડી ચૂકી છે. કેજરીવાલે પીએમ મોદી ઉપર નિશાન તાકતા

ટિવટ કરી લખ્યું છે કે, અત્યારે પ્રધાનમંત્રીજી પૂરી તાકાત સાથે આમ આદમી પાર્ટીની પાછળ પડ્યા છે. ખાસ કરીને દિલ્હી અને પંજાબ સરકારની પાછળ. જૂઠ ઉપર જૂઠ, જૂઠ ઉપર જૂઠ. તમારી પાસે તમામ એજન્સીઓની તાકાત છે પરંતુ ભગવાન અમારી સાથે છે. આ સમગ્ર કિસ્સાને ફેરવી-તોળવીને રજૂ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનના ઘરેથી માત્ર 2.80 લાખ મળ્યા છે. ED જે સંબંધીની વાત કરી રહી છે તેનો સત્યેન્દ્ર જૈન સાથે કોઈ સંબંધ જ નથી.



કાનપુર હિસા : 100 ગેરકાયદે ઈમારતો પર બુલડોઝર ફરશે, 50 લોકોની ધરપકડ કરાઈ

‘આ વખતે બુલડોઝર ચાલશે તો કફન પહેરી રસ્તા પર આવીશું’ કાઝીનું ફરી વિવાદાસ્પદ નિવેદન



કાનપુર

કાનપુર હિસા મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારે આકરું વલણ અપનાવ્યું છે. પોલીસે ૪૦ તોફાની તત્વોના પોસ્ટર જાહેર કર્યા પછી તંત્રે હવે ૧૦૦ ગેરકાયદે ઈમારતો પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરી છે. તંત્રે એવી ૧૫ ઈમારતોની યાદી તૈયાર કરી છે જે પહેલાં સીલ કરી દેવાઈ હતી, પરંતુ તેના સીલ તોડી નખાયા હતા. બીજાબાજુ પોલીસે કાનપુર હિસામાં સંડોવાયેલા કુલ ૫૦ લોકોની ધરપકડ કરી છે. કાનપુરમાં મુસ્લિમ સંગઠનોએ ૩૭ જૂને બંધની જાહેરાત કરી હતી. આ સમયે હિસા ફાટી નીકળી

હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી છે અને તેમના પોસ્ટર લગાવ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં ૫૦ લોકોની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટરો જાહેર કરાયા પછી કેટલાક લોકોએ જાતે જ આત્મસમર્પણ કર્યું હતું. કાનપુર હિસા મુદ્દે પીએફઆઈનું કનેક્શન પણ સામે આવ્યું છે. આ સંદર્ભમાં ૩ લોકોની ધરપકડ પણ કરાઈ છે. પોલીસે સૈકુલ્લાહ, મોહમ્મદ નસીમ અને મોહમ્મદ ઉમરની ધરપકડ કરી છે.

ભગવાન શિવ વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સપા નેતા લાલબિહારી યાદવ સામે કેસ

મુરાદાબાદ

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અને વિધાન પરિષદ (એમએલસી)ના સભ્ય લાલ બિહારી યાદવવિરુદ્ધ મુરાદાબાદના કંઠ પોલીસ સ્ટેશનમાં ભગવાન શિવ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. બજરંગ દળના કાર્યકરોએ સમાજવાદી પાર્ટી નેતાની ટિપ્પણી અંગે ફરિયાદ કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. યાદવ પર ભારતીય દંડ સંહિતની હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે, એક કથિત વીડિયોમાં એમએલસીયાદવે શિવલિંગ અને ભગવાન શિવ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. બજરંગ દળના નેતાઓએ ફરિયાદ નોંધાવતા આરોપ મૂક્યો છે કે, યાદવે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

હિન્દુઓ-પ્રવાસીઓ પર હુમલાને પગલે સૈન્ય એક્શન મોડમાં કાશ્મીરમાં આતંકીઓની મદદ કરતા 250 ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ

જમ્મુ-કાશ્મીર

કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક મહિનામાં સ્થાનિક હિન્દુઓ અને પ્રવાસીઓ પર હુમલા વકર્યા છે. તેના કારણે સુરક્ષા દળો સર્તક બન્યા છે અને તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. સુરક્ષાદળોએ 250 ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે, જેઓ આતંકવાદીઓની મદદ કરતા હતા અથવા તો તેમને જાણકારી પૂરી પાડતા હતા. આ લોકોની UAPA અને પબ્લિક સિક્યોરિટી એક્ટ હેઠળ ધરપકડ કરાઈ છે. તેમાંના મોટાભાગના લોકોને કાશ્મીર બહારની જેલમાં રખાયા છે. આ તત્વો વિરુદ્ધ કાર્યવાહીનો પ્રારંભ ગયા વર્ષે થયો હતો. મે 2021 સુધીમાં 150 લોકોની ધરપકડ કરી લેવાઈ હતી, પરંતુ આ આંકડાઓમાં છેલ્લા 5 મહિના દરમિયાન વધારો થયો છે. એકલા મે મહિનામાં જ લગભગ 50 લોકોની ધરપકડ કરાઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2020માં 135 લોકોની ધરપકડ કરાઈ હતી.

ઈડીએ પોન્ઝી લિંકડ સ્કીમમાં 200થી વધુ પ્લોટ, 3 રાજ્યોમાં ફ્લેટ જપ્ત કર્યા

એનબીએફસીનું લાઇસન્સ લીધા વગર પ્રમોટરોએ રોકાણકારો પાસેથી નાણા અંકત્રિત કર્યા

નવી દિલ્હી

ઈડીએ આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં મની લોન્ડરિંગ સ્કીમમાં ૨૦૦થી વધારે પ્લોટ્સ અને અનેક ફ્લેટ્સ જપ્ત કર્યા છે. આ પોન્ઝી સ્કીમના પ્રમોટરોએ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે. ઈડીના જણાવ્યા મુજબ આ સંપત્તિઓને ટાંચમાં લેવા માટે આદેશ જારી કરવામાં આવી ચૂક્યો છે. આ એસેટ કુલ ૧૧૦ કરોડ રૂપિયાની છે અને મૈત્રી પ્લાન્ટેશન એન્ડ

હોર્ટિકલ્ચર પ્રાઇવેટ લિમિટેડના નામે છે. આ કંપની શ્રી નક્ષત્ર બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (એસએનબીડીઆઈપીએલ), મૈત્રી રિયલ્ટર્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એમઆરઆઈપીએલ) અને તેના ડિરેક્ટરો લક્ષ્મી કોંડા રેડ્ડી, લક્ષ્મી મલયાદ્રી રેડ્ડી, લક્ષ્મી માધવા રેડ્ડી અને કોલિકાલાપુડી બ્રહ્મા રેડ્ડીની સિસ્ટર કન્સર્ન છે. કુલ ૨૧૦ એસેટ્સમાંથી ૧૯૬ પ્રોપર્ટીઝ આંધ્રપ્રદેશમાં છે, તેલંગણામાં

૧૩ અને કર્ણાટકમાં એક છે. આ પ્રોપર્ટીમાં ખુલ્લી જમીન, પ્લોટ અને ફ્લેટનો સમાવેશ થાય છે. કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવતી હતી અને તેણે એનબીએફસી તરીકેનું લાઇસન્સ લીધા વગર સામાન્ય લોકો પાસેથી ભંડોળ મેળવ્યું હતું. તેણે નિર્દોષ રોકાણકારો પાસેથી ડિપોઝિટ પેટે લાખોની રકમ મેળવી હતી. તેણે રોકાણકારોને ઊંચા વળતરના ખોટા વચનો આપી લોભાવ્યા હતા.

દેશમાં 93 ફરી કોરોનાનો કહેર એક જ દિવસમાં 5 હજાર કેસ

હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત : DGCA

નવી દિલ્હી

93 દિવસ પછી દેશમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ૫૦૦૦ને પાર થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૨૩૩ કેસ જ્યારે 7 લોકોના મોત થતાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૧,૮૦,૨૮૨ થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૨૮૮૫૭ થઈ ગઈ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. દેશમાં રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં

કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૮૪.૪૩ કરોડને પાર થઈ ગઈ છે. ૨૪ કલાકમાં નોંધવામાં આવેલા સાત મોત પૈકી પાંચ મોત કેરળમાં અને તથા એક-એક મોત દિલ્હી, યુપીમાં નોંધવામાં આવ્યું છે. DCGAએ હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરનારોની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તેમને અનિયંત્રિત ગણવામાં આવશે અને ફ્લાઈટમાંથી બહાર કાઢી દેવાશે.

RSSની ઓફિસોને ઉડાવી દેવાની ધમકી આપનારાની ધરપકડ

ચેન્નાઈ

RSSની ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનારા આરોપીની તમિલનાડુના પુડુકુડી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ રાજ મોહમ્મદ છે. સમગ્ર દેશમાં રહેલી RSSની 6 ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી તેથી પોલીસ પ્રશાસન ખળભળી ઉઠ્યું હતું. સોમવારે રાત્રે સમગ્ર દેશમાં રહેલી RSSની 6 ઓફિસોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં લખનૌની 2 ઓફિસોનો પણ સમાવેશ થાય છે.

દિલ્હી-NCRમાં આવતા વર્ષથી કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ : CAQM

નવી દિલ્હી

કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ 1 જાન્યુઆરી 2023થી સમગ્ર દિલ્હી-NCR ક્ષેત્રમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય વિવિધ પ્રયોગો માટે કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા નિર્દેશ જાહેર કર્યો છે. જોકે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ઓછા સલ્ફરવાળા કોલસાના ઉપયોગ પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. 3 જૂનના રોજ જાહેર કરાયેલા આદેશમાં CAQMએ જણાવ્યું હતું કે, કોલસાના ઉપયોગનો પ્રતિબંધ 1 ઓક્ટોબરથી PNG ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ધરાવતા વિસ્તારોમાં 1 જાન્યુઆરી 2023થી આ ક્ષેત્રમાં લાગુ થશે જ્યાં PNG સપ્લાય ઉપલબ્ધ હોય નહીં.



HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- ☞ Free Staging
- ☞ Free Professional Photography & virtual tour
- ☞ Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- ☞ Free Comparative Market Analysis
- ☞ Team of Professional for same price as hiring a single realtor
- ☞ Over 15 years of combined experience



NEW PRICE! Offers Anytime! This Home Is Located In A Family Neighbourhood In North Oshawa, Surrounded By Parks And Award Winning Schools, Minutes To All The Shopping, Cineplex, Harmony Creek Trail (Off Leash Dog Park), 407. The Home Features 3 Bedrooms, 3 Bathrooms, Finished Basement, 1484 Sq Ft Of Living Space Above Grade. A Rare Upper Level Family Room With Gas Fireplace Can Be Easily Transformed Into A 4th Bedroom If Needed.



Gorgeous Double Car Garage Townhouse With 4 Bedrooms. Hardwood Floor Top To Bottom. Only 8 Years Old. Approx. Over 2000Sq, Bright Functional Layout. Extra-Large Window Throughout. 9Ft Ceiling, Pot Lights & On Main. Upgraded Kitchen With Granite Counter, Stainless Steel Appliances, Backsplash & Large Center Island. Direct Access To Garage. 2 Car Driveway. Close To Hwy 401, Go Transit, Public Transit, Mall.



3+1 Bedrooms, 4 bathrooms
Welcome To 23 Ventris Dr. Beautiful Home In A Desirable Central West Community. Freshly Painted, Newer Kitchen With Quartz Countertop, Island With Breakfast Bar. W/O To Fully Fenced-In Oasis Backyard With 2 Tiered Deck & Beautiful Garden. Perfect To Entertain Guests. Hardwood Flooring, Potlights (Inside And Outside Of The Home), New Kitchen In The Bsmt. Spacious Bedrooms. Sep. Ent To The Bsmt Thru The Garage To A 1 Bedroom In-Law Suite. Close To Hwy 401, Plaza, Walking Distance To P.School.

- ◆ No Pressure
- ◆ No Obligation
- ◆ Just Answers to Your Questions... Its that Simple!

Call or DM for further details on this both amazing projects.

You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative

teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F: (416) 298-8303 | P: (647) 666-8676



Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



MOTEL for SALE

NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com

Website: <https://niraj-pancholi.c21.ca/>

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence

Major Achievements: Among TOP 75 PRODUCERS IN CANADA AWARD & CENTURION PRODUCER AWARDS 2017-2021

NEW: 31 ROOM MOTEL IN SAULT STE. MARIE

With 3 BR house, main street of downtown, minutes away from all amenities such as shopping malls, schools, college, hospital, airport etc. & Close to USA border.

Asking Price: \$1.7M

(about 40% to 45% down payment required)

URGENT LISTINGS REQUIRED MOTELS & HOTELS

Small Motels to Franchise Hotels anywhere in Ontario
Qualified Buyers are ready to close in 1 to 2 months

12 TO 45 ROOM MOTEL IN NORTHERN ONTARIO

Asking Price: \$900,000 To \$5,000,000
(40% to 50% down payment required)

MOTEL OPERATOR / WORKING PARTNER REQUIRED

Good Salary + Partnership (20% to 50%)
Minimum \$200,000 investment required

RECENTLY SOLD MOTELS NEAR.....

Blind River, Welland, London, Sarnia, North Bay,
Cochrane, Pembroke, Ottawa, Thunder Bay

JOB AVAILABLE: For the Motel located in Northern Ontario

- **Housekeeper** for room cleaning and general work in the motel, accommodation available for the couple / small family
- **Working Partner** Willing to invest min \$200K, stay & operate/manage the motel offering Partnership + Salary to operate